



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવાસંદર્ભ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧.
ટે.નં. ૨૫૭૮૧૮૧૧-૬૦ ફેક્સ: (૦૭૯) ૨૫૭૫૦૮૨૬

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ - ૨૦૦૫ (સને. ૨૦૨૧-૨૨)

પ્રોએક્ટીવ ડીસ્કલોઝર

ખાતાનું નામ : નાણાં ખાતુ

માહિતી અધ્યતન કર્યા તારીખ : ૦૧-૦૫-૨૦૨૧

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નાણાં ખાતુ

૧લો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ફોન નં. : ૨૫૩૮૯૮૧૧ ફેક્સ નંબર : (૦૭૯) ૨૫૩૫૦૮૨૬

(૧) નાણાં ખાતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો :

મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક બાબતો અંગેની તમામ વહીવટી કામગીરી તથા મ્યુ. ખાતાઓના આવક તથા ખર્ચના અને શહેરનાં વિકાસ કામો, પ્રોજેક્ટ્સ, યોજનાઓ વગેરે માટેના બજેટ પ્રોવિઝનની અને મ્યુ. તિજોરી વિભાગ દ્વારા નાણાંની લેવડટેવડની કામગીરી આ ખાતેથી થાય છે. તેમજ મ્યુનિસિપલ કર્મચારીઓનો પગારબાંધકારી, અભિપ્રાય તેમજ કર્મચારીઓના પગાર, પેન્શન અને નિવૃત્તિના લાભો આપવાની કામગીરી આ ખાતેથી થાય છે. નાણાંની લેવડટેવડનો સમય ચાલુ દિવસોએ ૧૧-૦૦ થી ૪-૦૦ છે.

નાણાં ખાતુ

૩. મ્યુનિસિપલ કમિશનર(ફાયનાન્સ)

!

ચીફ એક્ઝાઉન્ટન્ટ

!

૩. ચીફ એકા. (જનરલ)	૩. ચીફ એકા. (પેમેન્ટ)	એડી. ચીફ એકા. (બજેટ)	૩. ચીફ એકા. (તિજોરી)
!	!	!	!
આસિ. મેનેજર (જનરલ)	આસિ. મેનેજર (પેમેન્ટ)	આસિ. મેનેજર (બજેટ)	આસિ. મેનેજર (ફ્રેજરી)
!	!	!	!
(૧) પેન્શન	(૧) પેમેન્ટ વિભાગ	(૧) બજેટ	(૧) તિજોરી
(૨) ઈન્કમટેક્ષન	(૨) મેડી.રીઈભર્સમેન્ટ	(૨) ગ્રાન્ટ તથા લોન	(૨) ખાતાવહી
(૩) એ.એ.જી.	(૩) એલ.ટી.સી.	(૩) એફ.એ.એસ.-સેલ	(૩) ફિક્સ ડિપોઝીટ
(૪) જી.આઈ.એસ.	(૪) ગ્રી-ઓડીટ	(૪) સ્ટોર વેરીઝિકેશન	(૪) વાર્ષિક હિદ્ધાષો
(૫) રીટા.બેનીફિટ સેલ	(૫) એફ.એ.એસ.(બેક ગેરટી)	(૫) સર્વિસ ટેક્ષન	(૫) રેકર્ડ
(૬) બીલીંગ લોન	(૬) બીલ કલાર્ક		
(૭) આર.ટી.આઈ.	(૭) પી.એફ.		
(૮) કન્ટીજન્સી	(૮) ઈ.પી.એફ		
(૯) સાતમાંપગારપંચ	(૯) વેલ્ફેર		
(૧૦) એલ.આઈ.સી.	(૧૦) ન્યુ.પી.એફ.		
(૧૧) એવોર્ડ સેલ			

(૨) નાણાં ખાતાના અધિકારીઓ, અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો :

ડે. ભૂનિસિપલ કમિશનરશ્રી (ફાયનાન્સ)

ચીફ એકાઉન્ટન્ટશ્રી

ડે. ચીફ એકાઉન્ટન્ટશ્રી

આસિ. મેનેજર :

સીની. આસિ. એકાઉન્ટન્ટ

જુનિ. આસિ. એકાઉન્ટન્ટ

હેડ કેશીયર

ઓફિસ સુપ્રિન્ટેન્ટ

હેડ કલાર્ક

સીનીયર કલાર્ક

જુનીયર કલાર્ક

બીલ કલાર્ક

આર્મગાર્ડ

બાઇન્ડર

પણ્ઠાવાળા

નાણાં ખાતાની કામગીરી :

અમદાવાદ ભૂ.કોર્પો.ના સમગ્ર નાણાંકીય વ્યવહારો તથા કર્મચારી સંબંધિત વિવિધ કામગીરી નીચે જણાવેલ અલગ-
અલગ વિભાગો દ્વારા કરવામાં આવે છે. નાણાં ખાતું ચીફ એકાઉન્ટન્ટશ્રીની દેખરેખ નીચે ડે.ભૂ.કમિ.શ્રીની (ફાયનાન્સ)શ્રી ના
અંકુશ હેઠળ કાર્ય કરે છે.

નાણાં ખાતાના જુદા જુદા વિભાગની કામગીરી નીચે મુજબ છે.

❖ ચીફ એકાઉન્ટન્ટશ્રીના દેખરેખ હેઠળ -

- એડી. ચીફ એકાઉન્ટન્ટ (બજેટ)
- ડે. ચીફ એકાઉન્ટન્ટ (પેમેન્ટ)
- ડે. ચીફ એકાઉન્ટન્ટ (તિજોરી) અને
- ડે. ચીફ એકાઉન્ટન્ટ (જનરલ) ફરજ બજાવે છે.

● ડે.ચીફ એકાઉન્ટન્ટ (જનરલ વિભાગ)

ડે. ચીફ એકાઉન્ટન્ટ (જનરલ)શ્રી ના દેખરેખ હેઠળ આસિ. મેનેજરશ્રી (જનરલ) ફરજ બજાવે છે.

(૧) પેન્શન વિભાગ :-

મુનિસિપલ કોર્પોરેશન દ્વારા સને ૧-૧-૮ તથી પેન્શન યોજના રાજ્ય સરકારના ધોરણે પેન્શનના નિતિ નિયમો મુજબ પેન્શનની ચૂકવણી કરવામાં આવે છે. આ તમામ પેન્શનરોને બંક મારફતે વાર્ષિક ચૂકવવામાં આવે છે. નિવૃત્ત થયેલ કર્મચારીઓને પેન્શન કાર્ડ આપવામાં આવે છે. તેમજ પેન્શનરોને સારવાર પુસ્તિકા આપવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત પેન્શનર્સનાં ખોવાઈ ગયેલ, ફાટી ગયેલ તેમજ ફેમિલી પેન્શનનાં ડિસ્સામાં નવા પેન્શન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ આવી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે.

પેન્શનરોનાં વાર્ષિક આવકનાં પ્રમાણપત્ર ઈન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે આપવામાં આવે છે.

આ ઉપરાંત ૧૫ વર્ષ પૂરા કરતાં પેન્શનરને તેઓના પેન્શનની પુનઃસ્થાપન કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત વર્ષમાં એક વખત તમામ પેન્શનરોનાં હયાતી બાબતે હયાતી ફોર્મ ભરાવવામાં આવે છે. અને હયાતી અંગેની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ફોર્મની ખતવણી કરવામાં આવે છે. હયાતી ફોર્મ ન ભર્યા હોય તેવા પેન્શનરોના પેન્શન બંધ કરવાની કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત ફેમિલી પેન્શન ચાલુ કરવાની કામગીરી, પેન્શન બંધ કરવાની કામગીરી, સેવા પેન્શન ચૂકવવાની કામગીરી કરવામાં આવે છે.

મૂંસુ પામતા પેન્શનરનું પેન્શન બંધ કરવું. થયેલ વારસદારને મૂંસુ રાહત રકમ ચૂકવવી. હક્કદાર, વારસદારોનાં ડિસ્સામાં ફેમિલી પેન્શન ચાલુ કરવું. પેન્શન મા ઉત્તર પગાર નું, તેમજ નવા પગારપંચ મુજબનું ફિક્શેસન કરવાનું, તથા સુધારા અપેટ કરવા, ફેમિલી પેન્શન નક્કી કરવું, બંધ કરવાની તારીખ નક્કી કરવી. તે મુજબ મંજૂરી માંગવામાં આવે છે.

વર્ષ દરમ્યાન મૌંઘવારીમાં વધારો નક્કી થાય ત્યારે વધારા બાદની તારીખથી પેન્શન મૂળ પગારમાં સુધારો પામેલ પેન્શનરને અલગ તારવી તેના એરિયરની ગણતરી કરવી. વર્ષ દરમ્યાન બે વખત મૌંઘવારીમાં વધારો પેન્શન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

તમામ પેન્શનર્સ માટે શિઝ્યુલ લખવામાં આવે છે. સુધારા મુજબ ડેટા અપેટ કરવામાં આવે છે.

ભવિષ્યની ચોક્કસ તારીખે મૂળ પગારમાં ફેરફાર થતો હોય તેવા પેન્શનર્સ માટે રેડી-રેકનર અપેટ રાખવાની કામગીરી કરવામાં આવે છે.

બેન્કનાં પેન્શન હેન્ડલાંગ બિલની ચૂકવણી કરવામાં આવે છે.

આ ઉપરાંત વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા જે કોઈ લાભ પેન્શનરને આપવામાં આવે તેનો તાકીદ અમલ કરી લાભ આપવામાં આવે છે.

જનરલ ઈન્વર્ક્ડ : પેન્શન ફરિયાદ અંગે આવતી અરજીઓ ઈન્વર્ક્ડ કરી ડે. ચીફ એકાઉન્ટન્ટ સમક્ષ આ અરજીઓ મૂકી તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવે છે.

ફેમિલી પેન્શન મંજૂર કરાવવું, પુનઃ પેન્શન બાંધણી કરવી તેમજ પેન્શન અંગેના જરૂરી સુધારા કરાવવા તેમજ રાજ્ય સરકારના વખતોવખત બદલાતા નિયમોનુસાર પેન્શન બાંધણી કરાવવા, ગણતરી કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૨) ઈન્કમટેક્ષ વિભાગ :-

મુનિસિપલ કોર્પોરેશનના થતા કામોના વહેપારીઓના બીલોમાંથી જરૂરી સેલ્સ ટેક્ષ તેમજ ઈન્કમટેક્ષ ટી.ડી.એસ. કાયાય છે તેના લિસાબો તૈયાર કરવા તેમજ તેના બીલો બનાવી સરકારમાં જમા કરાવવા તેમજ આ અંગેના જરૂરી સર્ટિફિકેટો તૈયાર કરી કોન્ટ્રાક્ટર/સપ્લાયર્સને આપવા, વર્ષના અંતે કોર્પોરેશનના કર્મચારીઓને ચૂકવવામાં આવેલા પગારમાંથી વસુલ કરવાના થતા ઈન્કમટેક્ષની ગણતરી કરી તેના જરૂરી પત્રકો બનાવી, પાસ કરી અને આ રીતે નિર્ણિત થતી રકમના જરૂરી બીલો બનાવી ઈન્કમટેક્ષ વિભાગમાં જમા કરાવવા, કર્મચારીઓને આ અંગેના જરૂરી પત્રકો તૈયાર કરી સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.

(3) એ.એ.જી. વિભાગ :-

નાણાં ખાતાની એ.એ.જી. વિભાગ દ્વારા કર્મચારીઓના સર્વિસ મેટરોને લગતા પ્રશ્નો બાબતે વિવિધ કર્મચારીઓ – ખાતાઓ મારફતે પૂછવામાં આવતા અભિપ્રાયો આપવામાં આવે છે. એ.એ.જી. વિભાગ દ્વારા સ્ટેગડ ઈન્ક્રીમેન્ટ, પગાર ફિક્સેશન, સ્પે. રજાઓને લગતાં, સ્વૈચ્છિક નિવૃત્તિ/રાજીનામાં ને લગતાં, ધરભાડાને લગતાં, વાહન ભથ્થા, સસ્પેન્ડ થયેલા કર્મચારીઓના પગાર અંગેના અભિપ્રાયો આપવામાં આવે છે.

સમગ્ર કોર્પોરેશનના તમામ કર્મચારીઓના સ્ટેગડ, પગારની બાંધણી, તેના અભિપ્રાયો તેમજ જરૂરી રજાઓ અંગેના અભિપ્રાયો સીનીયર આસી. એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવે છે.

નોકરી બાબતમાં એટલે કે જરૂરી એવોઈ, ટી.બી. ની રજાઓ, પ્રસૂતી ની રજાઓ, એલ.ટી.સી વટાવ રજા, ઈન્ક્રીમેન્ટ અંગેના અભિપ્રાયો આપવાની કામગીરી કરવામાં આવે છે.

(4) જી.આઈ.એસ. વિભાગ (શુપ ઈન્સ્યુરન્સ સ્કીમ) :-

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ જી.આઈ.એસ. માં જોડાયેલા હોય તેવા કર્મચારીઓને કોર્પોરેશનની નોકરીમાંથી મુક્ત થયા હોય તેવા કર્મચારીઓના કેસમાં તેઓનો હિસાબ તપાસી ચૂકવણી કરવામાં આવે છે.

ખુનિસિપલ કર્મચારીઓના પગારમાંથી શુપ ઈન્સ્યુરન્સ તરીકે કપાતી રકમના ચેક લીસ્ટોમાં કપાયેલ રકમની ચકાસણી કરવી, રોજગારમાં તેની જરૂરી નોંધ કરવી, તેના પરથી હિસાબો તૈયાર કરી તે અંગેનું જરૂરી બીલ બનાવી અને બજેટ ચઢાવ્યા બાદ તેનો ચેક તૈયાર કરાવી બેન્કમાં ભરાવવાની કામગીરી કરવામાં આવે છે.

અવસાન / નિવૃત્ત પામતા કર્મચારીઓને શુપ ઈન્સ્યુરન્સની યોજનાનો લાભ આપવા તે અંગેનો જરૂરી હિસાબો કરવા તેમજ તે અંગેના જરૂરી બીલો બનાવી, પાસ કરાવી, સંબંધિત કર્મચારી / વારસદારને ચૂકવવાની કામગીરી કરવામાં આવે છે.

(5) રીટા. બેનેફીટ સેલ :-

નાણાં ખાતાના ટર્મિનલ બેનિફીટ સેલની કામગીરીમાં મુખ્યત્વે વર્ષ દરમ્યાન વિવિધ કારણોસર નોકરીમાંથી મુક્ત થતાં કર્મચારીઓનાં કેસોમાં કર્મચારીઓને નિવૃત્તિ, સ્વૈચ્છિક રાજીનામું, અન્કીટ, બરતરકી, અવસાન સમયે પ્રવર્તમાન નિતિનિયમો મુજબ ગ્રેજ્યુર્ટી, મૃત્યુ રાહત યોજના, લેણી નીકળતી રજાના રોકડ નાણાંમાં રૂપાંતર, કોમ્પ્યુટર પેન્શન તેમજ પેન્શન બાંધણી કરવાની કામગીરી કરવામાં આવે છે.

વર્ષ દરમિયાન ગ્રેજ્યુર્ટીનાં અભિપ્રાય આપવામાં આવે છે તેમજ તેના બીલો બનાવી પેમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવેલ છે તે પેટે ચૂકવણી કરવામાં આવે છે.

મૃત્યુ રાહત યોજના ડેટા કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થયું હોય ત્યારે તેમનાં વારસદારોને રૂ. ૨૫૦૦/- લેખે ચૂકવવામાં આવે છે.

વર્ષ દરમિયાન લેણી રજાનાં અભિપ્રાય આપવામાં આવે છે તેમજ તેના બીલો બનાવી પેમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે તેમજ તેની ચૂકવણી કરવામાં આવે છે.

(પ.૧) એલ.એ. કલોજ :- ખુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કે અવસાન પામતા કર્મચારીઓની નોકરી દરમ્યાન તેઓએ લીધેલ તમામ પ્રકારની રજાઓનો હિસાબ સર્વિસ બુકમાં બરાબર નોંધાયો છે કે કેમ? તે તપાસવું તેમજ આ કામગીરી કરતા વસુલ લેવાના થતા પગારની ગણત્રી કરવાની કામગીરી કરવામાં આવે છે.

(પ.૨) ગ્રેજ્યુર્ટી : કોર્પોરેશનના નિવૃત્ત કે અવસાન પામતા કર્મચારીઓને ચૂકવવાની થતી ગ્રેજ્યુર્ટી અંગે કર્મચારીની સમગ્ર નોકરીની વિગતો તપાસી મળવાપાત્ર ગ્રેજ્યુર્ટીની રકમ અને વસુલ લેવાની થતી રકમ અંગે અભિપ્રાય આપવાની કામગીરી કરવામાં આવે છે.

(પ.૩) ફાઈનલ પી.એફ. : નિવૃત્ત કે અવસાન પામતા કર્મચારીઓને તેઓના ખાતામાં જમા થયેલ પ્રો. ફંડની રકમની ચકાસણી, ગણત્રી, વસુલ થતી રકમ રીકવર કરવા, મળવાપાત્ર લીક ઈન્સ્યુરન્સની ગણતરી, વ્યાજની ગણતરી અને તે અંગેના બીલો બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ન્યુ પી.એફ.ના બીલો બનાવવાની કામગીરી, નિવૃત્ત, અવસાન, અન્કીટ તેમજ સ્વૈચ્છિક નિવૃત્ત થતાં કર્મચારીઓને કલીયરન્સ સર્ટિફીકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.

(પ.૪) પેન્શન : ખુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કે અવસાન પામતા કર્મચારીઓની સર્વિસ બુકમાં નોકરીની તમામ વિગતો તેમજ તેના વારસદાર અંગેના સમગ્ર પુરાવાઓ તપાસી જો તે જી.પી.એફ. સ્કીમમાં મળવાપાત્ર થતું પેન્શન કર્મચારી કે વારસદાર નક્કી કરીને આપવા અંગેના અભિપ્રાય આપવાની કામગીરી કરવામાં આવે છે.

(પ.૫) ગ્રેજ્યુરીટી, લેણી રજી, જ.આઈ.એસ. અને પેન્શનની ગણત્રી કરી બીલો બનાવવાની કામગીરી કરવામાં આવે છે.

(પ.૬) નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના નાણાંનું પત્રક આપવા, તૈયાર થતા બીલો ચેકીંગ કરવા, પાસ કરાવવા, બજેટ ચઢાવવા, ચેક લખવા આપવા, તેમજ ચેક લખાઈ ગયા બાદ બીલો પરત મેળવી રજીસ્ટરમા જરૂરી નોંધ કરી સંબંધિત કર્મચારી અને બીલ કલાર્કની સહીઓ લઈને આપવાની કામગીરી કરવામાં આવે છે.

(૬) બીલીંગ લોન વિભાગ :

બીલીંગ લોન તથા વાહનલોન હાલમાં આપવામાં આવતી નથી. પરંતુ જે ખુનિસિપલ કર્મચારીઓને બીલીંગ લોન આપવામાં આવેલી હોય તેવા કર્મચારીઓના બીલીંગ લોનના હિસાબો રાખવા તેમજ બીલીંગ લોન પૂરી થયે તેઓને લોન પૂરી થયાના સટીફિકેટ આપવાની તેમજ મોર્ગેજ છુટુ પાડવાની કામગીરી કરવામાં આવે છે.

(૭) રાઇટ ટુ ઈન્ફોરેમેશન :

નાણાં ખાતાના જુદા જુદા વિભાગોની પૂછવામાં આવેલ રાઇટ ટુ ઈન્ફોરેમેશનને લગતી તમામ પ્રકારની માહિતીના પ્રત્યુત્તર જાહેર માહિતી અધિકારી અને ડે. ચીફ એકાઉન્ટન્ટશ્રી દ્વારા આપવામાં આવે છે. જે તે વ્યક્તિ/સંસ્થાને આર.ટી.આઈ. બાબતે સંતોષકારક જવાબ ના લાગે તો તેઓ ફરીથી અપીલ અધિકારીશ્રીને અરજી કરે છે. ત્યારબાદ અપીલ અધિકારીશ્રી દ્વારા જે તે વ્યક્તિ/સંસ્થાને જવાબ સંતોષકારક ના લાગે તો તેમને અપીલ અધિકારીશ્રી દ્વારા રૂબરૂ મુલાકાત ગોઠવી સંતોષકારક રીતે જવાબ આપી તેઓની અરજી ફાઈલ કરવામાં આવે છે. અને ત્યારબાદ દર ગ્રાન્ટ માસે આર.ટી.આઈ.નો રિપોર્ટ તૈયાર કરી મોકલી આપવામાં આવે છે.

(૮) કન્ટીજન્સી :

નાણાં ખાતાના કર્મચારીઓ તેમજ અધિકારીશ્રીઓને જરૂરી કન્ટીજન્સી ઈન્ડેન્ટમાં ભરી જરૂરી મંજૂરી મેળવી સેન્ટ્રલ સ્ટોર્સમાંથી મેળવવી તેમજ જરૂરીયાત મુજબ બજારમાંથી ખરીદી કરી, મંજૂરી મેળવી, બીલો બનાવી ઈમ્પ્રેશ કેશમાં જમા કરાવવા તેમજ કન્ટીજન્સી પત્રકો તૈયાર કરાવી પાસ કરાવવા, ડેઝ સ્ટોક રજીસ્ટરો રાખવાની કામગીરી કરવામાં આવે છે.

(૯) સાતમું પગારપંચ વિભાગ :-

રાજ્ય સરકારશ્રીના ધોરણે ખુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૧ થી ઇન્ના તમામ કર્મચારીઓને તા. ૧-૧-૨૦૧૬થી સાતમાં પગારપંચનો અમલ કરવામાં આવ્યો છે તે તે મુજબ ખુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૧ થી ઇન્ના તમામ કર્મચારીઓને તા. ૧-૧-૨૦૧૬ થી સાતમાં પગારપંચની તમામ પ્રકારની કામગીરી જેવી કે - સરક્યુલરો કરવા, તમામ કર્મચારીઓનું તા. ૧-૧-૨૦૧૬થી ફિક્સેશન કરી પગારમાં તેનો અમલ આપવાનું તેમજ તેની તફાવતની ગણતરી કરી, રાજ્ય સરકારશ્રીના જી.આર.ના ધોરણે અમલ કરવાની તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

(૧૦) એલ.આઈ.સી. :-

ખુનિસિપલ કર્મચારીના પગારમાંથી વસુલ લેવામાં આવતી ગ્રીમીયમની રકમના જરૂરી હિસાબો કરી તેની જરૂરી નોંધ રજીસ્ટરોમાં કરી તેમજ વસુલ કરાયેલ રકમના બીલો બનાવી, પાસ કરાવી અને આ રકમ એલ.આઈ.સી.માં જમા કરાવવાની તેમજ સમયાંતરે જે કર્મચારીઓ નવા ઉમેરાય તેઓની જરૂરી નોંધ કરી કોમખુટરમાં તે અંગેના જરૂરી ડેટા મોકલવા તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓના કલીયરન્સ અંગેના જરૂરી સટીફિકેટો આપવા તેમજ ખુનિસિપલ કર્મચારીઓના પ્રિમિયમ અંગેના એલ.આઈ.સી. માં ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ, રૂબરૂ અથવા તો પત્ર દ્વારા કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૧૧) એવોર્ડ સેલ :-

ઉચ્ચતર પગારધોરણ એવોર્ડ સેલ બ્રાન્ચમાં ૧૯૮૬ અને ૧૯૯૫નાં એવોર્ડને ધ્યાનમાં લઈ ઉચ્ચતર પગારધોરણનું ફિક્સેશન કરવાની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવાની નીતિ સ્વીકારેલ હોવાથી અને તેનો અમલ આપવા માટે તેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ઉચ્ચતર પગારધોરણમાં પ્રત્યેક કર્મચારીની સર્વિસ બુકની પ્રત્યેક વિગતો અને જરૂરી નોંધો તપાસી તેમજ આ નોંધો ન હોય તો તેની નોંધો સંબંધિત બીલ કલાર્ક પાસે કરાવવી. રજાની ખતવણી પગાર રીકવરીની વિગતો ગણવી. તેની નોંધ કરવી. જુના પગારપંચોની વિગતો તપાસી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર છે કે કેમ? તે નક્કી કરી મળવાપાત્ર હોય તો આપવાની કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત ઘણા કર્મચારીઓને પાંચમા પગારપંચનો લાભ ઘણા કારણોસર મળેલ ન હતો. અને તેઓની માંગણી આવતા પાંચમા પગારપંચનો લાભ આપવાની પણ કામગીરી કરવામાં આવે છે.

ઉચ્ચતર પગારધોરણ આપ્યા બાદ કોઈ વિસંગતતાઓ ઉભી થતી હોય તો તેની આવેલ અરજાઓની હકીકતો તપાસીને તેનું નિરાકરણ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે.

તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વર્ગના કર્મચારીઓની ૮/૧૮/૨૭ને લગતી તમામ પ્રકારની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

● ૩. ચીફ એકાઉન્ટન્ટ (પેમેન્ટ વિભાગ) :

૩. ચીફ એકાઉન્ટન્ટ (પેમેન્ટ) શ્રી ના દેખરેખ હેઠળ આસિ. મેનેજરશ્રી (પેમેન્ટ) ફરજ બજાવે છે.

(૧) પેમેન્ટ વિભાગ :-

દરેક ખાતામાંથી આવતી ટપાલો લેવાની, રજ.માં નોંધી ટપાલમાં લખેલ જે તે અધિકારીની તરફ તેમજ જે તે ખાતે મોકલવાની ઉપરાંત પોસ્ટેજની કામગીરી, ટપાલો પોસ્ટ કરવાની, જુદા જુદા ટરાવો પાડવાના તથા કુરિયર મારફતે આવતી ટપાલો લેવાની, જવક લખવાના, તેમજ જરૂરી સરક્યુલરોનું ફાઈલીંગ કરવાની તેમજ ડિસ્પેચને લગતી તમામ પ્રકારની કામગીરી ડિસ્પેચ કલાર્ક દ્વારા કરવામાં આવે છે.

વિવિધ ખાતાઓમાંથી આવતાં કર્મચારીઓનાં એસ્ટાબ્લીશમેન્ટને લગતાં પગાર બીલો, પગાર પુરવણી, રોજંદા મજૂરોનાં પુરવણી બીલો, પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, મલ્ટી પરપણ મસ્ટરો, ટી.એ.ડી.એ.નાં બીલો, બોનસ, ફેસ્ટીવલ એડવાન્સ, ફુડ એડવાન્સ, મોંઘવારીના પુરવણી બીલો, મેરીકલ રીટર્ન મેન્ટનાં બીલો, ઈન્ક્રિમેન્ટ તફાવતનાં બીલો, ઓડીટ વિભાગનાં બીલો, એબસ્ટ્રેક્ટ વિગેરેની પાસીગની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની શેઠ વા.સા. હોસ્પિટલ સહિતની તમામ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલો, પ્રસુતિગૃહો, રેફરલ હોસ્પિટલો, એમ. જે. લાયબ્રેરીના તમામ કર્મચારીઓના પગાર બીલો પાસ કરવા તેમજ આ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓના રજા તેમજ નોકરી અંગેના જરૂરી અભિપ્રાયો આપવાની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓના પગાર બીલો તેમજ ઓવરટાઈમના બીલો તેમજ કર્મચારીઓને ચૂકવવાની થતી પરચુરણ પુરવણીની રકમની ગણતરી ચેક કરવી તેમજ તેની જરૂરી મંજૂરીઓ ચકાસવાની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતા તમામ પ્રકારના કામોના બનતા બીલો તેના બજેટ મુજબ રજીસ્ટરમાં નોંધવા તેમજ તે અંગેની જરૂરી નોંધ બીલ ઉપર કરવા માટેની કામગીરી તેમજ મ્યુ. કોર્પોરેશનના તમામ ખાતાઓનાં કોન્ટ્રાક્ટરના બીલો, વેપારીઓનાં બીલો તેમજ દરેક ખાતાના બીલ કલાર્કના ઈમેશના બીલો, જમા ખર્ચના બીલો, ટેલીફોનના બીલો, પરચુરણ બીલો વિ. ની મંજૂરીનો ઠરાવ તેમજ બીલ ઉપર લખેલ ઠરાવ જોઈને બીલ પેમેન્ટ માટે એડમીટ કરવાની કામગીરી તથા તમામ બીલો રજીસ્ટરે નોંધવાની તેમજ ટપાલમાં નોંધીને કોમ્પ્યુટરમાં ઈન્વર્ક માટે મોકલવા તેમજ મંજૂરીઓ જે તે બીલ કલાર્કને રજીસ્ટરે સહી લઈ પરત કરવાની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કર્મચારીઓને ચૂકવવામાં આવતા દરેક પ્રકારના બીલોને કોમ્પ્યુટરમાં ઈન્વર્ક કરવાની તેમજ તે જ બીલોને કોમ્પ્યુટરમાં બજેટ ચઢાવવાની કામગીરી તેમજ તે બજેટ ચઢેલ બીલોમાં સિક્કા મારી અધિકારીશ્રીની સહી કરાવી પેમેન્ટ માટે ઈ.સી.એસ. અથવા પે-ઓર્ડર માટે મોકલવાની કામગીરી તેમજ પ્રો. ફડ કે મ્યુનિસિપલ કર્મચારીઓની લ્હેણી ચૂકવવાની થતી રકમના બીલો પાસ થયા બાદ રજીસ્ટરમાં જરૂરી નોંધ કરી, બીલ કલાર્કને આપવાની કામગીરી કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતા તમામ પ્રકારના પેમેન્ટના બીલો ચેકીંગ થયા બાદ, ઈન્વર્ક કરાવ્યા બાદ તમામ પ્રકારના તેમજ સખાયર્સ, કોન્ટ્રાક્ટર્સના બીલોની મંજૂરી છૂટી પાડ્યા બાદ, સિક્કા મારીને રજીસ્ટરમાં નોંધીને બજેટ ચઢાવવા માટે બીલો મોકલવામાં આવે છે. ત્યારબાદ બજેટ ચઢાવ્યા બાદ તે. ચીક એકાઉન્ટન્ટશ્રીની સહી થયા બાદ તે દરેક પ્રકારના બીલો રજીસ્ટરમાં નોંધી ચેક લખવા માટે ટ્રેઝરીમાં મોકલાવવાની કામગીરી કરવામાં આવે છે.

(2) મેડીકલ રીઈમ્બર્સમેન્ટ :-

મ્યુનિસિપલ કર્મચારીઓ, મ્યુનિસિપલ પેન્શનરો, મ્યુનિસિપલ પેન્શનરો તથા તેઓના આશ્રિતોનામેડીકલ રીઈમ્બર્સમેન્ટના બીલો, મ્યુ. સ્ક્લુલ બોર્ડ તેમજ એમ. જે. લાયબ્રેરીના રીઈમ્બર્સમેન્ટના અભિપ્રાય, શેઠ વા.સા. જનરલ હોસ્પિટલની રીવોલ્ટીંગ ફંડની કામગીરી, રીઈમ્બર્સમેન્ટના બીલોમાં હદ્યરોગના દર્દને લગતી કામગીરી કરવાની હોય છે.

કામગીરી, માન્ય-અમાન્ય દવાઓ, તેમજ સીનીયર ચેકીંગની કામગીરી, તેમજ રીઈમ્બર્સમેન્ટના બીલોમાં માન્ય- અમાન્ય દવાઓની કામગીરી, જનરલ ચેકીંગની કામગીરી, તેમજ રીઈમ્બર્સમેન્ટના બીલોમાં જુનીયર ચેકીંગ, બીલો રજીસ્ટરે નોંધવા, એડમીટના સિક્કા મારવા, ટોટલ ચેક કરવા તેમજ રીઈમ્બર્સમેન્ટના બીલોને લગતી કામગીરી કરવાની હોય છે.

નાણાં ખાતાની મેડીકલ રી-ઈમ્બર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા વર્ષ દરમ્યાન કર્મચારીઓ, કાઉન્સિલરશ્રીઓ, પેન્શનરો તથા તેમના આશ્રિતોના મેડીકલ બીલોનું ચેકીંગ કરવાની કામગીરી કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન કર્મચારીઓના બીલોનું ચેકીંગ કરવામાં આવેલ છે અને રી-ઈમ્બર્સમેન્ટ પેટે ચૂકવવામાં આવે છે. જ્યારે પેન્શનરોના બીલોના ચેકીંગ અને રી-ઈમ્બર્સમેન્ટ પેટે ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સ્ક્લુલબોર્ડના કર્મચારીઓના મેડીકલ રી-ઈમ્બર્સમેન્ટ બીલોનું ચેકીંગ પણ કરવામાં આવે છે.

(3) એલ.ટી.સી. વિભાગ તેમજ ટી.એ. ડી.એ. :-

ખુનિસિપલ કર્મચારીને રાજ્ય સરકારના ધોરણે અપાતા પ્રવાસના લાભોની આવતી અરજીઓની ચકાસણી કરી, તે અંગે આપવાની થતી એડવાન્સ રકમના જરૂરી અભિપ્રાય આપવા તેમજ પ્રવાસ પૂરી થયા બાદ ખરેખર થતી મળવાપાત્ર રકમનાં અભિપ્રાય આપવા તેમજ ખુનિસિપલ કર્મચારી કે અધિકારીશ્રીઓના કોર્પોરેશનના કામ અર્થે કે તેઓને તાલીમ, કે અભ્યાસ માટે મોકલવામાં આવે ત્યારે તેઓને મળવાપાત્ર થતી રકમોના ટી.એ.ડી.એ.ના અભિપ્રાયો આપવાની કામગીરી કરવામાં આવે છે.

(4) પ્રિ-ઓડિટ :-

પ્રિ-ઓડિટ ખાત દ્વારા અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનના તમામ ખાતાના એક લાખ કે તેથી વધુ અંદાજ હોય તેવા રેવન્યુ તથા કેપીટલના તમામ બીલોનું નાણાં ચૂકવતાં પહેલ ઓડિટ કરવામાં આવે છે.

(5) બેંક ગેરંટી :-

નાણાં વિભાગ દ્વારા કોર્પોરેશનના અલગ અલગ ખાતા દ્વારા બેંક ગેરંટી ટેન્ડરની પ્રોસેસ વખતે લેવામાં આવે છે. તથા જે તે ખાતાની ભલામણ આવે તો પરત કરવાની કામગીરી સંદર્ભ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

(6) બીલ કલાર્ક :-

નાણાં ખાતાના કર્મચારીઓના પગાર બીલો બનાવવા, ખાતાના અધિકારીશ્રીઓના ધરના ટેલિફોનના બીલો બનાવી ટેલીફોન કંપનીમાં બીલોની ચૂકવણી કરવી તેમજ રજી ઉપર જતા કર્મચારીઓના રજાના ફોર્મ ભરીસર્વિસ બુકમાં તેની જરૂરી નોંધ કરવી. નાણાં ખાતાના કર્મચારીઓના તબક્કાવાર થતા ઈન્ક્રીમેન્ટ કરી તેની જરૂરી નોંધ સર્વિસબુકમાં રાખવી. નિવૃત્ત કે અવસાન પામતા કર્મચારીઓને અંતિમ લાભો આપવા માટે જરૂરી બીલો બનાવી, પાસ કરાવી અને ચૂકવણી કરવાની કામગીરી કરવી. સેન્ટ્રલ ઓફિસ કે અન્ય ખાતેથી અવારનવાર માંગવામાં આવતી માહિતીઓ પૂરી પાડવાની કામગીરી બીલ કલાર્ક દ્વારા કરવામાં આવે છે.

(7) પી. એફ. વિભાગ :-

નાણાં ખાતાના પી.એફ. વિભાગ દ્વારા કર્મચારીઓને તેમના આગલા વર્ષના પ્રમાણિત થયેલ પી.એફ. બેલેન્સમાંથી લોન આપવામાં આવે છે. અને રીફંડની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓની નોકરીના અંત સમયે ચૂકવવામાં આવતા ફાઈનલ પી.એફ. ફાળાની ચૂકવણી કરવામાં આવે છે અને ફાઈનલ પી.એફ.ની ચૂકવણી પેટે કર્મચારીઓને કર્મચારી જે યોજનામાં હોય તે યોજના પ્રમાણે સી.પી.એફ.માંથી અને જી.પી.એફ.માંથી ચૂકવણી કરવામાં આવે છે. તે ઉપરાંત લીક ઈન્સ્યુરન્સ પેટે કર્મચારીઓને ચૂકવણી કરવામાં આવે છે.

આ ઉપરાંત પી.એફ. વિભાગ દ્વારા દર વર્ષ વાર્ષિક હિસાબોની સ્લીપો તૈયાર કરીને કર્મચારીઓને વહેંયવામાં આવેલ છે. તેમજ દરેક વર્ષ વાર્ષિક હિસાબો કરી, બ્રોડશીટો બનાવી, દર પાંચ વર્ષે બનાવવામાં આવતા એડવાન્સ રજીસ્ટરો બનાવી, નવા એમ્પલોઇ નંબરો અને એમ્પલોઇર્સના જરૂરી પુરાવાઓ ચેક કરવાની કામગીરી કરવામાં આવે છે.

(7.1) લોન એડવાન્સ : ખુનિસિપલ કર્મચારીઓના પગારમાંથી કપાતી પ્રો. ફંડની રકમ જમા થાય છે. તેમાંથી લોન લેવા માટે આવેલ અરજીઓ ઈન્વર્ક કરવી, તેમજ તે તપાસવી. તે અંગે જરૂરી મંજૂરી માંગવી, બીલો બનાવવા વિ. કામગીરી કરવામાં આવે છે.

- (૭.૨) કર્મચારીઓને આપવામાં આવતી લોનોની ખતવજી કરવી, કપાત ભરવા માટે કોમ્પ્યુટર ફોર્મ ભરવા, એકલીસ્ટ ચેક કરવાની કામગીરી કરવામાં આવે છે.
- (૭.૩) **ઓડીટવાંધા** :- ચીફ ઓડીટ ખાતાના વાંધા, સરકારી હિસાબો, સરકારશીમાં જરૂરી રકમો જમા કરાવવાં, તેના હિસાબો તૈયાર કરી, બીલો બનાવી, પાસ કરાવી, રકમ જમા કરાવવાની કામગીરી કરવામાં આવે છે.
- (૭.૪) પ્રો. ફંડના બેલેન્સ અંગે આવતી અરજીઓના સર્ટિફિકેટ તૈયાર કરવા, કન્ટીજન્સીની વ્યવસ્થા કરવી, તેમજ દર વર્ષ કર્મચારીને આપવામાં આવતી પ્રો. ફંડની સ્લીપ અંગેની જરૂરી વ્યવસ્થા કરાવવાની કામગીરી કરવામાં આવે છે.

(૮) **ઈ. પી. એફ. વિભાગ :-**

રોજંદા કર્મચારીઓ કે જેઓ મિનિમમ વેઈજીસ એકટ મુજબ પગાર મેળવે છે તેવાં કર્મચારીઓનો ઈ.પી.એફ તેમના પગારમાંથી કાપી ઈ.પી.એફ. કાયદા મુજબ તેને ઈ.પી.એફ. ખાતામાં જમા કરવામાં આવે છે.

(૯) **વેલ્કેર વિભાગ :-**

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના હિત માટે જેવા કે મકાન ખરીદવા, મકાન રીપેરીંગ, સામાજિક ધાર્મિક કારણોસર કોર્પોરેશનમાં નોકરી કરતાં કર્મચારીઓને કોર્પોરેશનના વેલ્કેર લોન વિભાગના નીતિ નિયમો અનુસાર આ લોન તહ એક સરખા હપ્તેથી વસુલ લેવામાં આવે છે. જેથી કરીને તેઓ પોતાનું કાર્ય અથવા દેવું ચૂકુતે કરી શકે તે માટે વેલ્કેર ખાતા દ્વારા લોન પેટે ચૂકવવામાં આવે છે. અને તેની કોમ્પ્યુટરમાં નોંધ રાખવામાં આવે છે. જો કર્મચારીઓની વહેલી લોન પૂરી કરવાની અરજ આવેલ હોય તો લોન લીધાના બે વર્ષ પછી ગ્રી-પેઈડ ચાર્ઝસ લઈને લોનની બાકીની રકમ વસુલ લેવામાં આવે છે. અને જે તે કર્મચારીને વેલ્કેર લોન લીધાના તહ હપ્તા પૂરા થયા બાદ જ બીજી વખત વેલ્કેર લોન આપવામાં આવે છે.

(૧૦) **ન્યૂ પી.એફ. સ્કીમ :-**

તા. ૦૧-૦૪-૨૦૦૫ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમાણુંક પામેલ કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન સ્કીમ અમલમાં આવેલ છે. આ તમામ કર્મચારીઓનો સને ૨૦૧૪-૧૫ સુધીના કપાયેલ રકમના હિસાબો કરી તે અંગે ચૂકવવાના થતા વાજની ગજાતરી કરી, તે અંગે કોમ્પ્યુટર દ્વારા હિસાબો મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ ઉપર મૂકેલ છે તેમજ આ તમામ કર્મચારીઓના પ્રાણ નંબરના ફોર્મ ભરાવી, તેઓને પ્રાણ નંબર એલોટ કરાવી આપેલ છે. તેમજ આ અંગે ઉભા થતા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવી ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવેલ છે.

● ૩. ચીફ એકાઉન્ટન્ટ (બજેટ) :-

ડે.ચીફ એકાઉન્ટન્ટ (બજેટ)શ્રીના દેખરેખ હેઠળ આસિ. મેનેજરશ્રી (બજેટ, એફ.આ.એસ.) ફરજ બજીવે છે.

(૧) બજેટ વિભાગ :-

મ્યુ.કોર્પો.નું જનરલ બજેટ તૈયાર કરી સ્ટે.કમિટી તથા બોર્ડમાં મંજૂર કરાવવાની વિધી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સ્કુલ બોર્ડ, એમ.જે.લાયબ્રેરી તથા વી.એસ.હોસ્પિટલનાં બજેટની મંજૂરી બજેટ વિભાગ દ્વારા લેવામાં આવે છે. એડવાન્સીસનાં બજેટ તૈયાર કરી મંજૂરી મેળવવી, કેશફલો નીતિ નક્કી કરવી, તથા તેના રીલીઝ અંગેની મંજૂરી મેળવવી, બજેટ અંગેના અભિપ્રાયો આપવા, રીએપ્રોપ્રિઅશન સ્ટે.કમિટીમાં મંજૂર કરાવવા, વિવિધ નાણાંકીય સંસ્થાઓ તથા ગવર્નમેન્ટને નાણાંકીય પરિસ્થિતી અંગેના આંકડાઓ તથા માહિતી પુરા પાડવાની કામગીરી વર્ષ દરમ્યાન કરવામાં આવે છે. દરેક વર્ષ વાઈઝ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. દરેક જોનની માસિક નાણાંકીય જરૂરિયાત મુજબ જોનના બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાની જરૂરી મંજૂરી મેળવવાની કામગીરી કરવામાં આવે છે.

(૨) ગ્રાન્ટ તથા લોન :-

કેન્દ્ર સરકારશ્રી તેમજ સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ તથા સરકારી લોન તથા પણ્ણીક લોન મેળવવાની કામગીરી કરવામાં આવેલ છે.

(૩) એફ.આ.એસ સેલ :-

(૩.૧) મુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ બોન્ડના રોકાણકારોને સમયસર વાજની ચૂકવણી કરવાની, તથા બોન્ડનાં વ્યાજમાંથી નિયમાનુસાર ટી.ડી.એસ. કાપી સરકારશ્રીમાં જમા કરાવવાની, રોકાણકારોની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૩.૨) ફાયનાન્સીયલ એકાઉન્ટીંગ સીસ્ટમના ભાગ રૂપે આપવાના થતા નવા એકાઉન્ટ કોડ આપવાની કામગીરી કરવામાં આવે છે.

(૪) સ્ટોર વેરીફીક્રેશન વિભાગ :-

દરેક ખાતાની વાર્ષિક જરૂરિયાત મુજબ તૈયાર થતા કન્ટીજન્સી પત્રકોનું જરૂરી ચેકિંગ કરી તેના પાછલા વર્ષોના વપરાશ તથા જરૂરિયાત મુજબ જથ્થામાં વધ ઘટ કરી તે મંજૂર કરવાની કામગીરી

(૫) સર્વિસ ટેક્ષ :-

અમદાવાદ મ્યુ.કોર્પો દ્વારા આપવામાં આવતી સેવા પર પ્રવર્તમાન દર મુજબ સર્વિસ ટેક્ષ વસૂલવામાં આવેછે, તે અંગેના જે તે માસ દરમ્યાન સર્વિસ ટેક્ષની આવકના સ્ટેટમેન્ટ મેળવી સક્ષમ સત્તાની મંજૂરીના આધારે બિલ બનાવી સર્વિસટેક્ષ ડીપાર્ટમેન્ટમાં પછીના માસની પાંચમી તારીખ સુધીમાં ચલનથી જમા કરવામાં આવેછે, તથા આ અંગે સર્વિસ ટેક્ષ ડીપાર્ટમેન્ટ તરફ થી તથા CAG ઓફિસ તરફ થી જે તે વર્ષના ઓડીટ અંગેની કાર્યવાહી દરમ્યાન ઉપસ્થિત થતાં વાંધાઓનો નિકાલ કરવામાં આવેછે.

● ડે.ચીફ એકાઉન્ટન્ટ (તિજોરી) :

ડે.ચીફ એકાઉન્ટન્ટ(તિજોરી)શ્રીના દેખરેખ હેઠળ આસિ.મેનેજરશ્રી(તિજોરી) વિભાગના કર્મચારીઓ ફરજ બજાવે છે.

(૧) તિજોરી વિભાગ :-

ભુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતામાંથી આવતી તમામ રોકડ તથા ચેક બેંકમાં ભરવા તથા ચેક પેમેન્ટની કામગીરી ઉપરાંત ફીક્સ ડિપોઝિટ અંગેની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન રોકડ રીસીપી, બેંક રીસીપી, રોકડ પેમેન્ટ, બેંક પેમેન્ટ, તેમજ એડજસ્ટમેન્ટના નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા છે.

- (૧.૧) ઈન્વર્ક વિભાગમાં બજેટ ચઢીને પાસ થયેલા તમામ પ્રકારના બીલો કે જેની ચૂકવણી પે-ઓર્ડર/પેમેન્ટ એડવાઈઝ તૈયાર કરાવવી ઈ-મેઇલથી બેન્કને જાણ કરવી તેમજ તૈયાર થઈને આવેલા પે-ઓર્ડરની ચકાસણી કરી પેમેન્ટ માટે સંબંધિત સ્ટાફને આપવાની કામગીરી કરવામાં આવે છે.
- (૧.૨) ભુનિસિપલ કર્મચારીઓના રોકડ તેમજ પે-ઓર્ડરથી લેવા આવતા કર્મચારી/વેપારી જરૂરી પુરાવા તપાસી બીલોમાં જરૂરી નોંધ તપાસી તેઓએ કરેલી સહીઓ તપાસી ટોકન આપવા તેમજ તેની જરૂરી નોંધ કોમ્પ્યુટરમાં કરવામાં આવે છે.
- (૧.૩) આ પ્રમાણે અપાયેલ ટોકનવાળા બીલોનું રોકડ અથવા પે-ઓર્ડરથી પેમેન્ટ કરવા માટે આવતા બીલોની જરૂરી નોંધો કોમ્પ્યુટરમાં તપાસી આ નોંધો બીલ ઉપરની નોંધો સાથે સરખાવી ટોકન મેળવી, રજૂ કરનાર ટોકનવાળી વ્યક્તિને રોકડ અથવા પે-ઓર્ડર થી પેમેન્ટ આપવાની કામગીરી કરવામાં આવે છે.
- (૧.૪) ભુનિસિપલ કોર્પોરેશનમાં આવતી તમામ પ્રકારની રોકડ અને ચેકની આવકો કોમ્પ્યુટરમાં નોંધી તેના રજૂ થતાચીલનોમાં જરૂરી સહી કરી તે ચીલનો કર્મચારીઓને પરત આપી તેમની પાસેથી રોકડ આવક સ્વીકારવાની કામગીરી કરવામાં આવે છે.
 - (અ) તેમજ ચેકો સ્વીકારી તેના જરૂરી સ્ટેટમેન્ટો બનાવી તે અંગેના જરૂરી ચીલનો બનાવી અને બેન્કમાં ચેકો જમા કરાવવા માટે જરૂરી પત્રકો બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
 - (બ) આવેલ રોકડ આવકની નોટોના તેના પ્રકાર મુજબ બંડલો બનાવી, ગણતરી કરી અને આ આવકના બંડલો સ્ટ્રોંગ રૂમમાં જમા કરવાની કામગીરી કરવામાં આવે છે.
 - (ગ.) જમા આવેલ નાણાંના જરૂરી હિસાબો રાખવા, તેમજ આ વધારાની રોકડ રકમ તેના જરૂરી પત્રકો તૈયાર કરી બેન્કમાં જમા કરાવવા તેમજ બેન્કમાંથી રોજ-બ-રોજ બેલેન્સ લાવવું અને બેન્કમાં થતા જરૂરી ખર્ચના બીલો બનાવી તેની નોંધ કોમ્પ્યુટરમાં કરવામાં આવે છે.
- (૧.૫) તિજોરીમાં આવતી તમામ ફરિયાદીની ટપાલો ઈન્વર્ક કરવી તેમજ ૩. ચીફ એકાઉન્ટન્ટ સમક્ષ રજૂ કરી તેઓના હુકમ મુજબ જે તે વિભાગને મોકલતી નાણાં ખાતાના તિજોરીને લગતી આર.ટી.આઈ.ની કામગીરી અને પત્ર વ્યવહાર કરવામાં આવે છે.
- (૧.૬) ભુનિસિપલ આવકને જરૂરી બેન્કમાં ફીક્સ ડિપોઝિટ કરાવવા જરૂરી મંજૂરી માંગવી તેમજ તેના બીલો બનાવવા, રીન્યુઅલ કરાવવા જરૂરી મંજૂરી માંગવી, રોકડ કરાવવા માટે જરૂરી મંજૂરી માંગવી અને બેન્કમાં જમા કરાવવા અને આ અંગેના જરૂરી હિસાબો તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૧.૭) પેમેન્ટ થઈ ગયા બાદ તેની જરૂરી ચકાસણી થયા બાદ, ઓડીટ થયા બાદ, આ વાઉચરોને યોગ્ય અને વ્યવસ્થિત રીતે રેકર્ડ રૂમમાં રાખવાની કામગીરી કરવામાં આવે છે.

(૧.૮) ભુનિસિપલ કોર્પોરેશનમાં આવક તરીકે આવતા ચેકો કે જે રીટર્ન થાય તે ચેકોની સામે નાણાં ખાતા દ્વારા કોમ્પ્યુટર સીસ્ટમમાં ડીમાન્ડ વધ કરી કાનુની કાર્યવાહી કરવા માટે નોટિસ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૨) ખાતાવહી વિભાગ :-

વાઉચરો તેમજ ચિલનોનું ચેકલીસ્ટ સાથે ચેકીગ કરી કોમ્પ્યુટરમાં જરૂરી સુધારા વધારા કરી, ભ્ય.કોર્પો.નાં હિસાબો કરવાની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

પેમેન્ટ થયેલા વાઉચરોનો ખર્ચ યોગ્ય બજેટ હેડ અથવા તો એકાઉન્ટ કોડ નંબરની જરૂરી નોંધ વાઉચરોમાં થયેલ છે કે કેમ ? તે ચકાસવી અને યોગ્ય ન થયેલ હોય તો તેની જાણ આસિ. મેનેજરશીને કરી કોમ્પ્યુટરમાં તે પ્રમાણેના ખર્ચા પાડવાની કામગીરી અને વાઉચરોને તારીખ અને ટોકન નંબર પ્રમાણે રોજબરોજ બંધાવી વ્યવસ્થિત રાખવા તેમજ તેને ઓડીટમાં મોકલવા અને આ અંગે ઓડીટમાંથી કોઈ વાંધા આવ્યા હોય તો તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૩) હિસાબી કામગીરી : કર્મચારીઓની આવતી અરજીઓ પરતવે જુના હિસાબો, નવા હિસાબો મેળવવા, વાઉચરોની મેળવણી, ખતવણી કરવી, તેમજ સમગ્ર હિસાબો તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૪) વાર્ષિક હિસાબો :-

વર્ષના અંતે સિસ્ટમ પરથી કાયુ સરવૈયું તથા કુલ ખર્ચ અને કુલ આવક અંગેના હિસાબો તૈયાર કરી બોર્ડમાં પાસ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.

(૫) રેકર્ડની જાળવણી :-

અમદાવાદ ભુનિસિપલ કોર્પોરેશનના જુદા-જુદા ખાતા દ્વારા તિજોરી વિભાગમાં જમા કરાવેલ કેશ/ચેકની આવકના ચીલન તથા નાણાં ખાતે પેમેન્ટ માટે આવેલ વાઉચરની જાળવણી શિડ્યુલમાં જણાવ્યા પ્રમાણેના સમગ્ર સુધી કરવામાં આવે છે.

(૬) નાણાં ખાતાના કર્મચારીઓની હોદ્દો, ગ્રેડ અને પગારની વિગત દર્શાવતું પત્રક :-

અ.નં.	હોદ્દો	કુલ જગ્યા	પગારની ગ્રેડ / ગ્રેડ પે
૧	૨	૩	૪
૧	ચીફ એકાઉન્ટન્ટ	૦૧	૭૮૮૦૦-૨૦૬૨૦૦
૨	ડી.ચીફ એકાઉન્ટન્ટ	૦૫	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૩	આસિ. મેનેજર	૦૬	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪	હેડ કેશીયર	૦૨	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૫	ઓફિસ સુપ્રિન્ટેન્ટ	૦૩	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૬	સીની આસિ એકાઉન્ટન્ટ	૦૧	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૭	જુનિ. એકાઉન્ટન્ટ	૦૫	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૮	સ્ટેનોગ્રાફર-૨ (ટાઇપીસ્ટ-કમ-કલાક)	૦૨	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૯	હેડ કલાક	૧૮	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૦	સીનીયર કલાક	૮૬	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૧	આર્માડ	૦૭	૨૪૫૦૦-૮૧૧૦૦
૧૨	જુનિયર કલાક	૮૬	૨૪૫૦૦-૮૧૧૦૦
૧૩	બાઈન્ડર	૦૨	૧૬૬૦૦-૬૩૨૦૦
૧૪	પટાવણા	૩૬	૧૪૮૦૦-૪૭૧૦૦
	કાયમી કુલ....	૨૬૦	
	કુલ	૨૬૦	

(૬) નાણાં ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :-

ટેલિફોન નંબર			
ઓફિસ	ઘર	મોબાઇલ નંબર	
ડે. મુનિસિપલ કમિશનર (નાણાં)	૨૫૩૮૯૮૯૫૫૫		
શ્રી આર્જવ જે. શાહ	૨૫૩૮૯૮૯૯૯/૪૭૧		૮૩૨૭૦ ૩૮૮૨૪
સ્ટેનો : નીરજ ત્રિવેદી (નાણાં)	૨૫૩૮૯૮૯૯૯/૪૭૧		
	ફોક્સ : ૨૫૩૮૯૮૯૮૪૩		
ચીફ એકાઉન્ટન્ટ			
શ્રી અમિષભાઈ બી. શાહ	૨૫૩૮૯૮૯૯૯/૪૪૦	૦૭૯-૨૬૬૩૭૮૪૧	૮૩૨૭૦ ૩૮૭૮૮
શ્રી સ્ટેલીન મેથ્યુ (ટાઈપીસ્ટ)	૨૫૩૮૯૮૯૯૯/૪૪૩		
એડી. ચીફ એકાઉન્ટન્ટ :			
શ્રી ભાવિનભાઈ એ. પંડ્યા (બાંગેટ)	૨૫૩૮૯૮૯૯૯/૫૧૮	૦૭૯-૨૬૮૨૭૮૦૬	૮૩૨૭૦૩૮૭૧૪
ડે. ચીફ એકાઉન્ટન્ટ :			
શ્રી દિપકભાઈ ઈટાદરીયા (જનરલ)	૨૫૩૮૯૮૯૯૯/૪૪૨	૦૭૯-૨૬૮૨૨૮૪૮	૮૩૨૭૪૫૪૮૯૬
શ્રી નંદકિશોર કે. પુરોહિત (પેમેન્ટ)	૨૫૩૮૯૮૯૯૯/૪૪૭		૮૩૭૭૪૮૨૩૮૮
શ્રી દિપકભાઈ ઈટાદરીયા (ટ્રેઝરી)	૨૫૩૮૯૮૯૯૯/૪૪૨		૮૩૨૭૪૫૪૮૯૬
આસિ. મેનેજર્સ :			
શ્રી જતીન પટેલ (બાંગેટ)	૨૫૩૮૯૮૯૯૯/૪૮૫		૮૩૨૭૪૫૪૮૯૬
શ્રી વીણાબેન પટેલ (જનરલ)	૨૫૩૮૯૮૯૯૯/૪૮૩		૮૩૭૬૦૧૬૭૭૮
શ્રી દીપકભાઈ ઈટાદરીયા (પેમેન્ટ)	૨૫૩૮૯૮૯૯૯/૫૬૨		૮૩૬૬૦ ૧૬૮૦૩
શ્રી હેમલબેન ભાવસાર (ટ્રેઝરી)	૨૫૩૮૯૮૯૯૯/૬૪૫		૮૩૨૭૪૧૩૪૩૨
જુની.લીગલ આસિસ્ટન્ટન્ટ			
જગ્યા ખાલી			
જુની.આસિ. એકાઉન્ટન્ટ			
જગ્યા ખાલી			
(ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ)			
શ્રી પાયલ આર. વ્યાસ (એન.પી.એસ.)	૨૫૩૮૯૮૯૯૯/૫૬૩		
ઇ. શ્રી કનુભાઈ આર. રાઠવા (પી.એફ./વેલ્કેર)	૨૫૩૮૯૮૯૯૯/૫૬૩		
શ્રી ધનસુખ ભુસારા (એ.એ.જી.)	૨૫૩૮૯૮૯૯૯/૪૬૨		
શ્રી બદાભાઈ કટારા (ટ્રેઝરી)	૨૫૩૮૯૮૯૯૯/૬૪૫		
શ્રી ગીરીવતસિંહ બારીયા (હેડ કેશીયર)	૨૫૩૮૯૮૯૯૯/૫૫૪		
હેડ કલાર્ક			
શ્રી અશોકભાઈ કોલચા (પેમેન્ટ)	૨૫૩૮૯૮૯૯૯/૫૬૨		

- (૭) પોતાના કર્યાં બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળ ના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.

મુનિસિપલ કોર્પોરેશનના નીતી નિયમો તથા ધી બોમ્બે ગ્રોવીન્સીયલ મ્યુ.કોર્પો.એક્ટ-૧૯૪૮ ની જોગવાઈ મુજબ તથા ગુજરાત સરકાર ના મુલ્કીસેવા નિયમ-૨૦૦૨ મુજબ કાર્યવાહી કરવામા આવશે.

- (૮) પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજો ના વર્ગાનું પત્રક :-

અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો વખત અમલમા આવતા નીતિ નિયમ અનુસાર દસ્તાવેજો જાળવવામા આવે છે.

- (૯) તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સંબંધમા જનતાના સભ્યો સાથે વિચાર વિનીમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ ગોઠવણી વિગતો :-

આ બાબત આ વિભાગને લાગુ પડતું નથી.

- (૧૦) તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતીઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ ?

આ બાબત આ વિભાગને લાગુ પડતું નથી.

- (૧૧) અપીલ અધિકારીશ્રી અને જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો :-

- (A) અપીલ અધિકારીશ્રી અને એડી.ચીફ એકાઉન્ટન્ટશ્રી (બજેટ) : શ્રી ભાવિનભાઈ એ. પંડ્યા
- (B) અપીલ અધિકારીશ્રી અને ડે. ચીફ એકાઉન્ટન્ટશ્રી (પેમેન્ટ) : શ્રી નંદકિશોર કે. પુરોહિત
- (C) અપીલ અધિકારીશ્રી અને ડે. ચીફ એકાઉન્ટન્ટશ્રી (જનરલ) : શ્રી દીપકભાઈ ઈટાદરીયા
- (D) અપીલ અધિકારીશ્રી અને ડે. ચીફ એકાઉન્ટન્ટશ્રી (તિજોરી) : શ્રી દીપકભાઈ ઈટાદરીયા
- (E) જાહેર માહિતી અધિકારીશ્રી અને આસિ. મેનેજરશ્રી (જનરલ) : શ્રી વીણાબેન પટેલ
- (F) જાહેર માહિતી અધિકારીશ્રી અને આસિ. મેનેજરશ્રી (પેમેન્ટ) : શ્રી દીપકભાઈ ઈટાદરીયા
- (G) જાહેર માહિતી અધિકારીશ્રી અને આસિ. મેનેજરશ્રી (તિજોરી) : શ્રી હેમલબેન ભાવસાર
- (I) જાહેર માહિતી અધિકારીશ્રી અને આસિ. મેનેજરશ્રી (બજેટ) : શ્રી જતીન પટેલ

- (૧૨) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી : આ બાબત નાણાં વિભાગ ને લાગુ પડતું નથી.